

Date: 2nd February, 2022

To,
Department of Corporate Service
BSE Limited,
P. J. Tower,
Dalal Street, Fort,
Mumbai-400 001

Dear Sir / Madam,

**BSE SCRIP CODE: 509835** 

Sub: Compliance under Regulation 47 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("Listing Regulations")

Pursuant to Regulation 47 of the Listing Regulations, please find enclosed copies of notices given to shareholders informing them about the meeting of Board of Directors of the Company to be held on Thursday, February 10, 2022 published in the following newspaper;

1. Financial Express (English) edition, Dtd.02/02/2022

2. Financial Express (Gujarati) edition, Dtd.02/02/2022

Please take note of the same. This is for your information and record.

Thanking you, Yours faithfully,

For, Premier Synthetics Limited

Vismay Makwana Company Secretary

Encl: as above

Regd. Off. : Surana House, B/h. Klassic Chambers, Swastik X Road, Opp. Narnarayan Complex, Navrangpura,

Ahmedabad-380009, Gujarat.

Phone / Fax : 079-26430946, 079-26431558 E-mail : premiersynthetics@gmail.com Website : www.premiersyntheticsltd.com

Factory Add.: Plot No. 835-837, Nr. Rakanpur Chowkadi, Rakanpur, Tal. Kalol. Dist.: Gandhinagar - 382721, Gujarat.

5 Phone / Fax : 02764-286761 E-mail : premiersynthetics18@gmail.com

Regd. Office: 21, Basant Lok Complex, Vasant Vihar, New Delhi 110057 CIN: L17100DL1985PLC303047 TEL. NO. +91-011-41403205 Website: www.srmenergy.in Email: info@srmenergy.in Extract of Standalone and Consolidated Unaudited Results for the Quarter and Nine Months Ended 31.12.2021 Standalone Consolidated Nine Nine Year Year **Particulars** Quarter Months Quarter Quarter Months Quarter ending ending ending ending ending ending ending (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) (Unaudited) (Unaudited) (Unaudited) (Audited) 31.12.2021 31.12.2021 31.12.2020 31.03.2021 31.12.2021 30.12.2021 31.12.2020 31.03.2021 0.09 1.11 6.51 3.25 12.17 Other Income Net Profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items) (12.31)(34.98) (9.72)(42.95)(15.81)(60.75)(180.90) (2,077.10) Net Profit/(Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items) (12.31)(34.98)(9.72)(42.95)(15.81)(60.75)(180.90) (2,077.10) Net Profit/(Loss) for the period after Tax (after Exceptional and/or Extraordinary Items) (12.31)(34.98)(9.72)(42.95)(18.69)(63.63)(180.90) (2,079.10) Total comprehensive income for the period [Comprehensive Profit/(Loss) for the period (after tax) and other comprehensive income (after tax) (12.31)(34.98)(9.72)(42.95)(18.69)(63.63)(180.90) (2,079.10) Paid up Equity Share Capital (Face value of 906.00 906.00 906.00 906.00 906.00 906.00 906.00 906.00 Rs. 10/- each) (1,154.04)(5,126.80)Other equity Earnings Per Share (of Rs 10/- each) (for continuing and discontinued operations)-(0.21)(0.11)(0.47)(2.00)(22.95) Basic (0.39)2. Diluted (0.14)(0.47)(0.21)(22.95)(0.39)(0.11)(0.70)(2.00)

SRM ENERGY LIMITED

NOTES: The above is an extract of the detailed format of Unaudited Financial Results for the quarter and nine months ended 31st December, 2021 filed with Stock Exchange under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the quarterly results is available on the stock exchange website www.bseindia.com and on the company website www.srmenergy.in

The above Unudited Financial Results of the Company for the quarter and nine months ended December 31, 2021 has been reviewed by the Audit Committee and approved by the Board of Directors at its meeting held on February 01, 2022. For and On behalf of Board

Vishal Rastogi

(Amount in lakhs of ₹, unless otherwise stated)

Managing Director

Place: New Delhi Date: February 01, 2022

## **NEULAND LABORATORIES LIMITED**

(CIN: L85195TG1984PLC004393)

Regd. Office: 11th Floor (5th Office Level), Phoenix IVY Building, Plot No. 573A-III, Road No 82, Jubilee Hills, Hyderabad - 500033

SI. No.		Quarter Ended 31.12.2021	Quarter Ended 31.12.2020	Nine Months Ended 31.12.2021	Nine Months Ended 31.12.2020
1	Total Income	23,836.99	24,558.71	69,944.66	69,370.70
2	Net profit for the period before tax	1,823.59	3,194.77	5,788.72	8,094.34
3	Net profit for the period after tax	1,293.56	2,673.52	4,204.13	6,333.81
4	Total comprehensive income for the period	1,259.84	2,686.09	3,794.52	6,325.67
5	Paid-up Equity Share Capital (Face value - ₹10 each)	1,290.05	1,290.05	1,290.05	1,290.05
6	Earnings Per Share (of ₹10 each) (In absolute ₹ terms)				
	(a) Basic	10.08	20.84	32.77	49.37
	(b) Diluted	10.08	20.84	32.77	49.37

EXTRACT OF CONSOLIDATED UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31 DECEMBER 2021

Note 1: The financial results for the quarter ended 31 December 2021 have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meeting held on 01 February 2022.

Note 2: Key Standalone Financial Information:			(An	nount in lakhs of ₹)
Particulars	Quarter Ended 31.12.2021	Quarter Ended 31.12.2020	Nine Months Ended 31.12.2021	Nine Months Ended 31.12.2020
Total Income	23,836.99	24,558.71	69,944.66	69,370.68
Net profit for the period before tax	1809.81	3,185.82	5,761.81	8,064.62
Net profit for the period after tax	1273.23	2,667.17	4,170.68	6,306.69

Note 3: The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Unaudited Financial Results are available on the Stock Exchange websites, www.nseindia.com and www.bseindia.com and on the Company's website www.neulandlabs.com

By Order of the Board For and on behalf of the Board of Directors

Dr. D.R.Rao Place: Hyderabad **Executive Chairman** Date: 01 February 2022 (DIN 00107737)

# SHARAT INDUSTRIES LIMITED

CIN: L05005AP1990PLC011276 Regd Office: Venkannapalem Village, T.P.Gudur Mandal, Nellore District, AP Pin 524002

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31 DECEMBER 2021 All amount in Rupees in Lakhs (Except per share data)

		Quarter Ended			Nine Mon	Year Ended	
SI. No	Particulars	31-Dec-21	30-Sep-21	31-Dec-20	31-Dec-21	31-Dec-20	31-Mar-21
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
1	Total income from Operations	5,805.68	6,675.47	6,811.26	19,424.22	20,404.08	25,283.38
2	Total Expenses	5,715.47	6,560.36	6,717.54	19,015.24	20,018.94	24,893.96
3	Net Profit before tax for the period (before tax, Exceptional and/or Extraordinary items)	90.20	115.11	93.72	408.97	385.14	389.42
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	65.11	83.09	67.65	295.20	277.99	258.47
5	Total comprehensive income for the period [comprising profit for the period (after tax) and other comprehensive income] (after tax)	65.11	83.09	67.65	295.20	277.99	261.62
6	Equity share capital	2,201.25	2,201.25	2,201.25	2,201.25	2,201.25	2,201.25
7	Other equity excluding Revaluation Reserve	8					
8	Earnings per share Face value of Rs. 10 each						
	Basic and Diluted EPS In Rs	0.30	0.38	0.31	1.34	1.26	1.19

Note: a) The above is an extract of the detailed format of Quarter ended financial results filed with the stock Exchanges under regulation 33 of the SEBI (Listing obligations and Disclosure requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results are available on the Stock Exchange website (www.bseindia.com) and also on the website of the company at www.sharatindustries.com. b) Previous periods' figures have been regrouped wherever appropriate to confirm to current periods' presentation.

Place: Nellore Date: 31/01/2022 For SHARAT INDUSTRIES LIMITED S.Prasad Reddy **Managing Director** (DIN: 00069094)

## **GRP Limited** (CIN: L25191GJ1974PLC002555)

Tel no.: 022 67082600 / 2500, Fax: 022 67082599, e-mail id: investor.relations@grpweb.com, website: www.grpweb.com EXTRACT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED 31st DECEMBER, 2021

3.3			Standalone		Consolidated			
Sr	_ , ,	Quarter ended		Nine months ended	Quarter ended		Nine months ended	
No.	Particulars	31-12-2021	31-12-2020	31-12-2021	31-12-2021	31-12-2020	31-12-2021	
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	
1	Total Income from Operation (Net)	9,330.54	8,456.41	27,667.53	9,341.96	8,463.85	27,719.56	
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	106.19	233.45	336.89	108.04	233.91	335.28	
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	106.19	233.45	336.89	108.04	233.91	335.28	
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	77.56	164.26	346.91	79.00	164.17	344.10	
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	98.47	196.99	307.50	99.91	197.91	305.08	
6	Equity Share Capital	133.33	133.33	133.33	133.33	133.33	133.33	
7	Other Equity (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year		-	-	-	-	_	
8	Earnings Per Share (of ₹ 10/- each) (for continuing and discontinued operations) (*Not Annualised)	8 8		8				
	1. Basic : (in ₹)	5.82 *	12.32 *	26.02 *	5.93 *	12.31 *	25.81 *	
	2. Diluted : (in ₹)	5.82 *	12.32 *	26.02 *	5.93 *	12.31 *	25.81 *	

The above is an extract of the detailed format of Quarterly/ Nine months ended Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly/ Nine months ended Financial Results are available on the Stock Exchange websites (www.nseindia.com & www.bseindia.com) and on the Company's website (www.grpweb.com). The above results have been reviewed by the Audit committee and approved by the Board of Directors at their meeting held on 31st January, 2022.

Figures for the previous period are regrouped/reclassified wherever necessary, to make them comparable.

**FOR GRP LIMITED** Place : Mumbai HARSH R. GANDHI JOINT MANAGING DIRECTOR Date: 31st January, 2022



TENDER NOTICI Sealed tenders IN TWO BID S Contractors for the following:	E No. 01/FEB/2022 YSTEM are invited from reput
Ref No.	: ICTS/TIFR/2021-22/SER-36
Item Description	Tender for Annual Maintenan : Contract for Landscape Horticulture Works at ICTS-TIF
Estimated Cost	Rs.58 Lakhs (Rupees Fifty Eight Lakhs Only)
Earnest Money Deposit (EMD)	Nil. Bid Securing Declaration to be submitted as per Annexure
Pre-Bid Meeting	: 18 February 2022 at 11.00 h
Last Date for Submission of Tender	: 04 March 2022 till 15.00 hrs
Date of Opening Tender	: 04 March 2022 at 15.30 hrs

## ZEN TECHNOLOGIES LIMITED

Regd. Office: B-42, Industrial Estate, Sanathnagar, Hyderabad, Telangana - 500 018 CIN: L72200TG1993PLC015939

## Extract of Un-Audited Financial Results for the Nine Months Ended & Quarter Ended 31st December 2021

						(Rs. in lakhs)
	Standalone Consolid		Standalone Consolidat			557 539
Particulars	Quarter ended 31 Dec, 2021	Nine months ended 31 Dec, 2021	Quarter ended 31 Dec, 2020	Quarter ended 31 Dec, 2021	Nine months ended 31 Dec, 2021	Quarter ended 31 Dec, 2020
	Un-audited	Un-audited	Un-audited	Un-audited	Un-audited	Un-audited
Total Revenue from Operations	1,235.70	3,774.02	1,587.51	1,625.75	4,197.40	1,657.12
Net Profit/(Loss) for the period before tax	64.35	115.58	362.94	29.93	(200.61)	269.28
Net Profit/(Loss) for the period after tax	11.83	62.36	268.86	(22.48)	(253.74)	175.20
Total Comprehensive Income/(Loss) for the period [Comprising Profit/(Loss) after tax and Other Comprehensive Income/(Loss) after tax]	11.83	62.36	268.86	(22.33)	(261.20)	177.41
Paid up Equity Share Capital (Re.1/- Per Equity Share)	795.10	795.10	795.10	795.10	795.10	795.10
Reserves (excluding Revaluation Reserve as shown in the Balance Sheet of previous year ended)	28,232.37	28,232.37	20,378.03	27,167.33	27,167.33	19,469.21
arnings Per Share (of Re.1/- each) Not Annualised): a) Basic (In Rs.)	0.01	0.08	0.34	(0.02)	(0.17)	0.29
) Diluted (In Rs.)	0.01	0.08	0.34	(0.02)	(0.17)	0.29

Note: The above is an extract of the detailed format of Quarterly Financial Results filed with the Stock: Exchange under Regulations 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Quarterly Financial Results are available on company's website at www.zentechnologies.com and the stock exchange's websites, www.nseindia.com and www.bseindia.com

> For and on behalf of the Board Ashok Atluri Chairman and Managing Director DIN:00056050

the Company will be held on Thursday 10th February, 2022 at 11:00 A.M. at th registered office of the Company at Surana House, Behind Klassic Chambers, Swastil X Rd, Opp. Narnarayan Complex Navrangpura, Ahmedabad-380009, inte alia, to consider & approve the Unaudited

S. E. RAILWAY - TENDER

Tender Notice No.: DRMENGGRNC-02

2022, dated 31.01.2022. Tender is invite

by Divisional Railway Manager (Engg)

S.E.Railway, Ranchi for and on behalf o

The President of India for the following work

Name of Work: Provision of 03 Nos

Escalators at Ranchi Railway station and

01 No. Escalator at Hatia Railway station

Tender Value : ₹ 1.66.51.150.02. Earnest

Money: ₹ 2,33,300/-. Tender Closing

date & time: 23.02.2022 at 15.00 hrs. Tenderers can visit the website www.ireps.

PREMIER SYNTHETICS LIMITED

CIN - L70100GJ1970PLC100829

Reg. Office: Surana House, Behind Klassic Chambers

Swastik X Rd, Opp. Narnarayan Complex,

Navrangpura, Ahmedabad-380009, Gujarat. NOTICE

The Meeting of the Board of Directors of

(PR-59L)

v.in for online tendering.

Financial Results for the Quarter and Nine months ended on 31st December, 202 and to transact any other business with the permission of chairman. For furthe details please refer the web-link http:// www.premiersyntheticsltd.com/ & https:// /www.bseindia.com/stock-share-price premier-synthetics-ltd/premsyn/509835 For. Premier Synthetics Limited

Date: 01/02/2022 Vismay Makwana **Place: Ahmedabad Company Secretary** 

**IHCL** 

Place: Hyderabad

Date: 29th Jan, 2022

## THE INDIAN HOTELS COMPANY LIMITED

Registered Office: Mandlik House, Mandlik Road, Mumbai 400 001

CIN: L74999MH1902PLC000183, Email: investorrelations@tajhotels.com, Website: www.ihcltata.com

EXTRACT OF STANDALONE AND CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

			CTANDAL ONE	_	₹ lakhs
	STANDALONE				
Particulars	Quarter Ended 31.12.2021 (Reviewed)	Quarter Ended 31.12.2020 (Reviewed)	Ended 31.12.2021		Yea Ended 31.03.202 (Audited
Total income from operations	74087	40874	140976	66919	113315
Net Profit/ (Loss) for the period (before tax and Exceptional items)	14796	(6229)	(11471)	(47224)	(48498)
Net Profit/ (Loss) for the period before tax	14465	(11851)	(13639)	(58222)	(64028)
(after Exceptional items)					
Net Profit/ (Loss) for the period after tax	12409	(9484)	(12005)	(47524)	(52478)
(after Exceptional items)		2			
Total Comprehensive Income for the period [Comprising Profit/	7401	(2568)	(14266)	(32689)	(31572)
(Loss) for the period (after tax) and Other Comprehensive					
Income (after tax)]	V0.				
Paid-up Equity Share Capital (Face Value per share -₹ 1 each)	13214	11893	13214	11893	11893
Other Equity	585764	407828	585764	407828	408945
Securities Premium	466048	270206	466048	270206	270206
Net Worth	598978	419721	598978	419721	420838
Outstanding Debt	166506	259543	166506	259543	259179
Debt Equity Ratio (in times)	0.28	0.62	0.28	0.62	0.62
Earnings Per Share (of₹1/- each)			^		
(for continuing and discontinued operations) -					
Basic and Diluted (in₹) (*not annualised):	*1.00	*(0.77)	*(0.97)	*(3.87)	(4.28)
Capital Redemption Reserve	112	112	112	112	112
Debenture Redemption Reserve	10704	15501	10704	15501	15501
Debt Service Coverage Ratio (in times)	0.21	0.34	0.21	0.34	0.00
Interest Service Coverage Ratio (in times)	1.28	0.68	1.28	0.68	0.00
					₹lakhs
		С	ONSOLIDATE		

basic and bildled (iii ) ( not annualised).	1.00	(0.77)	(0.31)	(3.01)	(4.20)
Capital Redemption Reserve	112	112	112	112	112
Debenture Redemption Reserve	10704	15501	10704	15501	15501
Debt Service Coverage Ratio (in times)	0.21	0.34	0.21	0.34	0.00
Interest Service Coverage Ratio (in times)	1.28	0.68	1.28	0.68	0.00
					₹ lakhs
		С	ONSOLIDATE	ED .	
Particulars	Quarter Ended 31.12.2021 (Reviewed)	Quarter Ended 31.12.2020 (Reviewed)	Ended 31.12.2021	31.12.2020	Ended
Total income from operations	111122	55986	218414	96014	157516
Net Profit/ (Loss) for the period (before tax and Exceptional items)	11969	(17644)	(33452)	(88181)	(100949)
Net Profit/ (Loss) for the period before tax (after Exceptional items)	10945	(14840)	(33526)	(74721)	(84954)
Net Profit/ (Loss) for the period after tax (after Exceptional items)	9596	(13322)	(33654)	(69791)	(79563)
Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	6102	(1499)	(31526)	(49822)	(52836)
Paid-up Equity Share Capital (Face Value per share -₹ 1 each)	13214	11893	13214	11893	11893
Other Equity (including Non-controlling interest)	575967	419378	575967	419378	416408
Securities Premium	466048	270206	466048	270206	270206
Net Worth	589181	431271	589181	431271	428301
Outstanding Debt	272967	358772	272967	358772	363284
Debt Equity Ratio (in times)	0.46	0.83	0.46	0.83	0.85
Earnings Per Share (of₹ 1/- each) (for continuing and discontinued operations) -	(0)	*	8		
Basic and Diluted (in₹) (*not annualised):	*0.61	*(0.97)	*(2.61)	*(5.13)	(5.87)
Capital Redemption Reserve	1079	1079	1079	1079	1079
Debenture Redemption Reserve	10704	15501	10704	15501	15501
Debt Service Coverage Ratio (in times)	0.15	0.13	0.15	0.13	(0.11)
Interest Service Coverage Ratio (in times)	0.93	0.28	0.93	0.28	(0.23)

- 1. The above is an extract of the detailed format of the Statement of Standalone and Consolidated Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Statement of Standalone and Consolidated Financial Results for the quarter and nine months are available on the websites of Stock Exchanges at www.bseindia.com and www.nseindia.com and also on the Company's website at www.ihcltata.com.
- 2. The above results have been reviewed by the Audit Committee of the Board and approved by the Board of Directors at its meetings held on February 1, 2022. The results have been reviewed by the Statutory Auditors of the Company.
- 3. The above results are in accordance with the Companies (Indian Accounting Standards) Rules, 2015 as prescribed under Section 133 of the Companies Act, 2013 read with the relevant rules issued thereunder and the other accounting principles generally accepted in India.

Mumbai February 1, 2022

**Puneet Chhatwal** Managing Director & CEO (DIN: 07624616)

MAS RURAL HOUSING & NORTGAGE FINANCE LIMITED

કરજદાર/સહ કરજદાર/જમીનદાર નું ધ્યાન દોરવામાં આવે છે કે, સદર કાયદાની કલમ ૧૩ની સબ-સેક્શન (૮) મુજબ સદર મિલ્કતની પુનઃ પ્રાપ્તિ માટે ઉપલબ્ધ સમયમાં ક્લેઈમ કરી શકે છે.

tidding storestitists.			
કરજદાર/સહ-કરજદાર/ જામીનદારનાં નામ	સ્થાવર મિલકતનું વર્ણન	લોન એકાઉન્ટ નં પઝેશનની તારીખ	બાકી નીકળતી લેણી રકમ (જે ડિમાન્ડ નોટિસમાં જણાવ્યા પ્રમાણે)
મલ્લીકાબેન ઈશ્વરભાઈ પટેલ	જત રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીકટ સબ - ડીસ્ટ્રીકટ વલસાડ ખાતે	લોન એકાઉન્ટ	તા. ૦૩-૦૬-૨૦૨૧ના રોજ બાકી
(SI3&EI5)	આવેલ મોજે પારડીશાંઠપોર તા.વલસાડ જી. વલસાડ	નંબર : ૧७૩૬	રૂા.૧૩,૨૦,૪૫७.૦૦
દશ્ચરભાદ્ય દાવછભાદ્ય પટેલ	ખાતે આવેલ રેવન્યુ સર્વે નં. ૬૦/૦૨/૧ અને	39-09-२०२२	(અંકે રૂપિયા તેર લાખ વીસ હજાર
(સલ-અરજદાર)	૬૦/૦૨/૦૨ પર આવેલ સ્ક્રીમ કે જે "લક્ષ્મીનારાયણ		ચારસો સતાવન પુરા)
દિવ્યેશ ઈશ્વરભાઈ પટેલ (સહ-અરજદાર)	ટાઉનશીપ"ના નામથી ઓળખાય છે તેના ફલેટ નં.		
ભક્તિ આનંદ નાચક (જામીનદાર)	બી/૧૦૪ પહેલો માળ કે જેનું ક્ષેત્રફળ ૭૧.૦૦ ચો.મી.		
હરીશભાઈ મગનભાઈ હલપતી	(બિલ્ટએપ એરીયા) અને વણવહેંચાયેલ જમીનનો		
(અમીનદાર)	હિસ્સો કે જેનું ક્ષેત્રફળ ૨૯.૨૯ ચો.મી. છે તેવી મિલ્કત		

S	SHARAT I  C  Regd Office : Venkannapalen	IN : L05005	AP1990PL	C011276						
	STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER ENDED 31 DECEMBER 2021 All amount in Rupees in Lakhs (Except per share data)									
SI.			uarter Ende		Nine Mon	Year Ended				
No	Particulars	31-Dec-21	30-Sep-21	31-Dec-20	31-Dec-21	31-Dec-20	31-Mar-21			
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited			
1	Total income from Operations	5,805.68	6,675.47	6,811.26	19,424.22	20,404.08	25,283.38			
2	Total Expenses	5,715.47	6,560.36	6,717.54	19,015.24	20,018.94	24,893.96			
3	Net Profit before tax for the period (before tax, Exceptional and/or Extraordinary items)	90.20	115.11	93.72	408.97	385.14	389.42			
4	Net Profit for the period after tax (after Exceptional and/or Extraordinary items)	65.11	83.09	67.65	295.20	277.99	258.47			
5	Total comprehensive income for the period [comprising profit for the period (after tax) and other comprehensive income] (after tax)	65.11	83.09	67.65	295.20	277.99	261.62			
6	Equity share capital	2,201.25	2,201.25	2,201.25	2,201.25	2,201.25	2,201.25			

Basic and Diluted EPS In Rs Dease no consultation of the detailed format of Quarter ended financial results filed with the stock Exchanges under regulation 30 of the SERI (Listing obligations and Disolosure requirements) Regulations, 2015. The full format of the Quarterly financial results an available on the Stock Exchange website (www.bseindia.com) and also on the website of the company at www.sharatindustries.com in Pervious seriors flowers have been regrouped wherever appropriate to confirm to current periods presentiation.

Date : 31/01/2022

7 Other equity excluding Revaluation Reserve 8 Earnings per share Face value of Rs. 10 each

eseniation.

HARAT INDUSTRIES LIMITED

S.Prasad Reddy

Managing Director

(DIN: 00069094)

### એચ્ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટે ડ (શક્યુલ્ડ કોમશિયલ બેંક) ૨ઝુસ્ટર્ડ ઓફીસ : ૧૯–એ, ધુલેશ્વર ગાર્ડન, અજમેર રોડ, જથપુર-૩૦૨૦૦૧ (CIN:L36911RJ1996PLC011381)

પરિશિષ્ટ –૪ (જુઓ નિચમ ૮ (૧)) કબજા નોટીસ મો, ૨૦૦૨નાં નિષમ (૩) સાથે વંચાતી કલમ ૧૩ (૧૨) હેઠળ વાંચીને મળેલી સત્તાની કુએ **એષ સ્મોલ ફાયનાન્સ બેંક લીમીટેડ (ધિડ્યુલ્ડ ક્રેમસિંયલ બેંક)**ના નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ ની

	૧૩(૨) નોટીસની	ગીરો મિલકતની	કળજો લીધાની
જામીનદારોનાં નામ/ લોન નંબર	તારીખ અને રકમ	વિગત	તારીખ
મિલન લેસ (દેવાદાર) મનોજભાઇ કોળી (સત-દેવાદાર),	૧૨–ઓક્ટોબર-૨૧	મ્યુન્સિયલ કોર્પોરેશન પ્લોટનં. લી ૬ ૨૦ ચંદ્રદીય સોસાયટી, ઉપના સુરત આશાનગર ગે૧ પાસે, સુરત,	
બાબુભાઇ પટેલ (સત-દેવાદા૨), જ્યોતિ મનોજ કોળી (સત-	રૂા. ૧૪,૭૩,૩૫૧/-	ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન / બિલ્ડીંગ / સ્ટ્રક્ચર અને ફ્રીક્ચર્સના તમામ	
દેવાદાર), જ્યોતિ મનોજ કોળી (સત-દેવાદાર),	રૂા. ચૌદ લાખ તોતેર તજાર	ભાગ અને હિસ્સા. <b>ક્ષેત્રફળ ૬૫ ચો. યા</b> દ	૨૨-જાન્યુઆરી-૨૦૨
માંચરે હિતેશ બાબુભાઇ (સત-દેવાદાર)	ત્રણસો એકાવન પુરા		
(A/c No.) L9001060117936947	૧૩ – ઓક્ટોબર – ૨૧મુજ બ		
પતંજની ચિકિત્સાલય એવમ સ્ટોર (દેવાદાર),	૧૩-ઓક્ટોબર-૨૧	મ્યુન્સિયલ કોર્યોરેશન ફ્લેટ નં. ૨, બીજો માત્ર, ગીરવ એપાર્ટમેન્ટ, થાનગડ શેરી જાયા બજા રસુરત	
સોની હેમલતા દશરથ (સહ-દેવાદાર),	રૂા. ૧૦,૧૨,૧૮૦/-	,ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન / બિલ્ડીંગ / સ્ટ્રક્ચર અને ફ્રીક્ચર્સના તમામ	
દશરથ કનૈયાલાલ સોની (સત-દેવાદાર)	રૂા. દસ લાખ બારહજાર	ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળા ૬૪૫ થો. ચાર્ડ	૨૭-જાન્યુઆરી-૨૦
(A/c No.)L9001060119096689	એકસો એંસી પુરા		
	૧૩–ઓક્ટોબર-૨૧મુજબ		
કમલેશ લાલજીભાઇ બાખરીયા (દેવાદાર)	૧૩–ઓક્ટોબર-૨૧	પ્લોટ નં. ૩૩, વિશામ નગર, અખાનંદ કોલે સામે, વેદ રોડ, સુરત, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ	
વાલીબેન લાલજીભાઇ બાબરીયા (સત-દેવાદાર),	રૂા. ૧૭,૭૬,૦૧૬/-	/કોર્મસીયલ મિલકત જમીન /બિલ્ડીંગ / સ્ટૂકચર અને ફીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા.	
હિનાબેન કમલેશભાઇ બાબરીયા (સહ-દેવાદાર)	રૂા. સત્તર લાખ છ્યોતેર હજાર	ક્ષેત્રફળ ૩૩૯ ચો.ચાર્ડ	૨૭-જાન્યુઆરી-૨૦
(A/c No.) L9001060100092562	સોવ પુરા	· ·	
	૧૩–ઓક્ટોબર-૨૧મુજબ		
ઓમ હરીહર મોટર્સ (દેવાદાર) ભટ્ટ મયંકકુમાર મુકેશચંદ્ર	૨૬-જુલાઇ-૨૧	તાઉસ ગાયતવ પ્રોપર્ટી રજીસ્ટર્ડ ગામ કાલમ તાલુકો તાંસોટ મિલકત નં. ૧, તનુમાન ફવિયા, જિશ્લો ભરૂ	
(સત-દેવાદાર), જિનલબેન મર્યક્કુમાર ભટ્ટ (સત-દેવાદાર)	રૂા. ૭,૫૨,૯૩૭/-	ચ, કાલમ તાંસોટ, ભરૂચ ગુજરાત ખાતેની રેસીટેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન / બિલ્ડીંગ / સ્ટ્રક્ચર	1
(A/c No.) L9001060119136550,	રૂા. સાત લાખ બાવન હજાર	અને ફીક્ચર્સના તમાય ભાગ અને હિસ્સા. <b>ક્ષેત્રફળ ૮૦ થો.ફટ/થો.યા ડે/યો.મી.</b>	૨૯-જાન્યુઆરી-૨૦
	નવસો સાડત્રીસ પુરા		_
	૨૨-૪લાઇ-૨૧ મુજબ		
રેવાભાઇ મોતનભાઇ ભીષોર	૦૧-જાન્યઆરી-૧૮	પ્લોટ નં. ૧૫૩. સીટી સર્વે નં. ૯૨૩૪ પૈકી. મોજે સરદારનગર. તાલકો સીટી. જિલ્લો- અમદાવાદ.	
(દેવાદાર અને ગીરવેદાર).	31. 9 8.39. 988/-	ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન / બિલ્ડીંગ /સ્ટ્રક્ચર અને ક્રીક્ચર્સના તમામ	
શ્રીમતીમંજુમેન રેવાભાઇ ભીધોર (સત-દેવાદાર)	રૂા. ચીદ લાખ એકત્રીસ તજાર	ભાગ અને હિસ્સા. ક્ષેત્રફળ પર.૩૦ ચો.મી., પ્લોટ એરિયા અને ૩૨.૬૦ ચો.મી. બાંધકામ એરિયા	૩૦-જાન્યુઆરી-૨૦
(A/c No.)L9001060100023204	પાંચસો ચમાલીસ પરા	પર્વ: અન્ય મિલકત, પશ્ચિમ: ૧૫૪ સાથેની કોમન દિવાલ . ઉત્તર: રોડ, દક્ષિણ: અન્ય મિલકત સાથેની	
,	રદ્-હિસેમ્બર-૧૦ મુજબ	કોમન દિવાલ	
નાગદેવ વી ભોઇ (દેવાદા૨),	રદુ-જુલાઇ-૨૧	મ્યુન્સિપલ કોર્પોરેશન શોપ નં. ૧૪, ગ્રાઉન્ડ ફ્લોર, રાયેક્રપણા પેલેસ દાસ્તાન ગામ, ગુજરાત ખાતેની	
નિર્મલા નાગદેવ ભોઇ (સત-દેવાદાર)	રૂા. ૯,૧૧,૩૨૩/-	રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન / મિલ્ડીંગ / સ્ટ્રક્ચર અને ફ્રીક્ચર્સના તમામ ભાગ અને હિસ્સા.	
શ્યામભાઇ એકાતભાઇ ભોઇ (સત-દેવાદા૨)	રૂા. નવ લાખ અગ્યાર તજાર	ક્ષેત્રફળ ૧૩૩ ચો.ફટ/ચો.ચા.ઇ/ચો.ચી.	૩૦-જાન્યુઆરી-૨૦
		***	
(A/c No.)L9001060115407261.	ત્રણસાં ત્રેવીસ પરા		
(A/c No.) L9001060115407261,	ત્રણ સો ત્રેવીસ પુરા ૨૨-૪લાઇ-૨૧ મજબ		
(A/c No.) L9001060115407261,	ત્રણ સાત્ર ત્રવીસ પુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જલાઇ-૨૧	મ્યન્સિપલ કોર્પોરેશન શોપ નં. ૨. ગ્રાઉન્ડ કલો૨. કલિકા પેલેસ. સ્માર્ટ ગ્રીન સીટી સોસાયટી નદી થી છેયા	
લાભુભાઇ મોતનભાઇ (દેવાદા૨),	૨૨-૪ુલાઇ-૨૧ મુજબ ૨૬-૪ુલાઇ-૨૧	મ્યુન્સિયલ કોર્પોરેશન શોપ નં. ૨, ગ્રાઉન્ડ ફ્લોર, કલિકા પેલેસ, સ્માર્ટ ગ્રીન સીટી સોસાયટી નૂટી મીડીયા કેલ લાકેટલ સરબ લાકેટલ પ્રથમાતા સ્વલ્સન આવેની ડેસીએલીકલ હોર્પોરીયલ વિલ્લાન જાણેન /	
,	૨૨-જુલાઇ-૨૧ મુજબ	રોડ, કારોદરા, સુરત, કારોદરા, પલસાણા, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન /	૩૦-જ્ઞન્યઆરી-૨૦
લાલુલાઇ મોતનભાઇ (દેવાદાર), કાથીરીયા લાલુલાઇ મોતનભાઇ (સત-દેવાદાર), અરૂણબેન લાલુલાઇ કાથીરીયા (સત-દેવાદાર)	રર-જુલાઇ-ર૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂક્ષ. ૮,૭૨,૨૪૮/- રૂક્ષ. આઠલાખ બોતેરહજાર		૩૦-જન્યુઆરી-૨૦
લાબુબાઇ મોતનભાઇ (દેવાદા૨), કાથીરીયા લાબુભાઇ મોતનભાઇ (સત્ર-દેવાદા૨),	રર-જુલાઇ-ર૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂ. ૮,૭૨,૨૪૮/- રૂા. આઠલાખ બોતેર તજાર બસો સુડતાલીસ પુરા	રોડ, કારોદરા, સુરત, કારોદરા, પલસાણા, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન /	૩૦-જાન્યુઆરી-૨૦
લાભુભાઇ પોતનભાઇ (દેવાદાર), કાચીરીયા લાભુભાઇ પોતનભાઇ (સત-દેવાદાર), અરૂદ્ધાવેન લાભુભાઇ કાચીરીયા (સત-દેવાદાર) (Ac No.)L9001060119660393,	રર-જુલાઇ-ર૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂક્ષ. ૮,૭૨,૨૪૮/- રૂક્ષ. આઠલાખ બોતેરહજાર	રોડ, કારોદરા, સુરત, કારોદરા, પલસાણા, ગુજરાત ખાતેની રેસીડેન્સીયલ /કોર્મસીયલ મિલકત જમીન /	૩૦-શ્વન્યુઆરી-૨૦:
લાભુભાઇ મોતનભાઇ રિચાકાર), કાચીરીયા લાભુભાઇ મોતનભાઇ (સત-દેવાકાર), ન્યુટ્રામ્મેન લાભુભાઇ કાચીરીયા (સત-દેવાકાર) (Ale No.)1.9001060119660393, લાભુભાઇ મોતનભાઇ રિચાકાર),	રર-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂ. ૮,૦૨,૨૪૮/- રૂ. આઠલાખ બોતેર તજીર બસો સુડતાલીસ પુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧	હો., કાંગ્રેલ્ટ, ગુરુલ, કાંગ્રેલ્ટ, પલ્લાણા, ગુજલા ખાતેની રેલીકેલીયા (કોર્યસીયાલ વિલાક જનોન/ વિલ્કીંગ / ગુરુલા અને દીક્સાર્લલ તથાય ભાગ અને હિસ્સા <b>તે વક્ષ્ય ૨૮૬ થો. ફાંગ્રેલ. માર્કિયો. મી.</b> ખાતિયાલ કોર્યસાલ સોપ ને. ૪, આઇન્ડ ફ્લોર, કહિલા પેલેલ, સ્માર્ટ સીન સીદી સોકાયલી નૃદી મીડિયા	૩૦-જ્ઞન્યુઆરી-૨૦:
લાલુભાઇ મોતનભાઇ દિવાદર), કાથીવીયા લાભુભાઇ મોતનભાઇ (સત-દેવાદાર), અરૂદાએન લાભુભાઇ કાથીવીયા (સત-દેવાદાર) (Arc No.) L9001060119660383, લાભુભાઇ મોતનભાઇ (દેવાદાર), કાથીવીયા લાભુભાઇ મોતનભાઇ (સત-દેવાદાર),	રર-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ ફ્રા. ૮,૦૨,૨૪૮/- ફ્રા. આઠલાખ બોતેર તજાર બસો સુડતાલીસ પુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ ફ્રા. ૮,૯૧,૦૫૨/-	રોક, પ્રકારક, મુખ્ય, પ્રકારક, પલસાણ, ગુજરાત ખાતેની રેલી ખીધ પા કોર્પસીયલ વિશ્વાસ વધીન / વિલ્કીય (સ્ટ્રાયર મને કીરાર્પના તમાર ભાગ અને દિસ્સા <b>લેવકલ ૨૮૬ થી. ફાર્યો પા કિંગો થી.</b> મુખ્યિયલ કોર્પીસ્થવ સોપ નં પ, પ્રાઈન્ક ક્લોર, કંકિક પ્રખેત, આર્ટ મીન સીટી સોસાપરી તુરી મીડીય હો. પ્રકારક, સુખ, પ્રકારક, પલસાણ, ગુજરાત ખાતેની રેલીક્સીયલિય કિંપીક્સીયલ વિશ્વાસ ભાગ પ્રયોગ	
ભાષુભાઇ ચોતનભાઇ રિવાદર રે, કાર્યવિધા લાભુભાઇ મોતનભાઇ (સત-રેનાદર રે, અફદારેબ લાભુભાઇ કાર્યવિધા (સત-રેનાદર રે (Ac N.a.) 1900 1060 119600333, લાભુભાઇ ચોતનભાઇ (સાંત-રેનાદર રે, કાર્યવિધા લાભુભાઇ મોતનભાઇ (સત-રેનાદર રે, સ્થાર્યોબ લાભુભાઇ કાર્યાવિધા (સત-રેનાદર રે,	૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ ૮,૭૨,૨૪૮/- રૂદ આક લાખ ભોતેર હાઇટ બસો સુડતાલીસ પુરા ૨૨-જુલાઇ-૨૧ રૂદ આદ લાખ બેઠાલુ હાઇટ રૂદ આદ લાખ બેઠાલુ હાઇટ	હો., કાંગ્રેલ્ટ, ગુરુલ, કાંગ્રેલ્ટ, પલ્લાણા, ગુજલા ખાતેની રેલીકેલીયા (કોર્યસીયાલ વિલાક જનોન/ વિલ્કીંગ / ગુરુલા અને દીક્સાર્લલ તથાય ભાગ અને હિસ્સા <b>તે વક્ષ્ય ૨૮૬ થો. ફાંગ્રેલ. માર્કિયો. મી.</b> ખાતિયાલ કોર્યસાલ સોપ ને. ૪, આઇન્ડ ફ્લોર, કહિલા પેલેલ, સ્માર્ટ સીન સીદી સોકાયલી નૃદી મીડિયા	
લાલુભાઇ મોતનભાઇ દિવાદર), કાથીવીયા લાભુભાઇ મોતનભાઇ (સત-દેવાદાર), અરૂદાએન લાભુભાઇ કાથીવીયા (સત-દેવાદાર) (Arc No.) L9001060119660383, લાભુભાઇ મોતનભાઇ (દેવાદાર), કાથીવીયા લાભુભાઇ મોતનભાઇ (સત-દેવાદાર),	રર-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂ	રોક, પ્રકારક, મુખ્ય, પ્રકારક, પલસાણ, ગુજરાત ખાતેની રેલી ખીધ પા કોર્પસીયલ વિશ્વાસ વધીન / વિલ્કીય (સ્ટ્રાયર મને કીરાર્પના તમાર ભાગ અને દિસ્સા <b>લેવકલ ૨૮૬ થી. ફાર્યો પા કિંગો થી.</b> મુખ્યિયલ કોર્પીસ્થવ સોપ નં પ, પ્રાઈન્ક ક્લોર, કંકિક પ્રખેત, આર્ટ મીન સીટી સોસાપરી તુરી મીડીય હો. પ્રકારક, સુખ, પ્રકારક, પલસાણ, ગુજરાત ખાતેની રેલીક્સીયલિય કિંપીક્સીયલ વિશ્વાસ ભાગ પ્રયોગ	
લાલુલાઇ લોહનવાડ (દેવાદર), કાર્યોલિય લાલુલાઇ લોહનવાડ (૧૯-૨-૧૯દર), બ્લુકારેલ લાલુલાઇ લાંદી લાંદન-દેવાદર), બ્લુકારેલ લાલુલાઇ લાંદી લાંદન-દેવાદર), (ભાગનાઇ લોહનવાડ (દેવાદર), કાર્યોલિયા લાલુલાઇ લોહનવાડ (દેવાદર), કાર્યોલિયા લાલુલાઇ લોહનવાડ (ભાગનાઇ (ભાગનાઇ), કાર્યોલિયા લાલુલાઇ લોહનવાડ), કાર્યોલિયા લાલુલાઇ લોહનવાડ (ભાગનાઇ),	૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ ૮,૭૨,૨૪૮/- રૂદ આક લાખ ભોતેર હાઇટ બસો સુડતાલીસ પુરા ૨૨-જુલાઇ-૨૧ રૂદ આદ લાખ બેઠાલુ હાઇટ રૂદ આદ લાખ બેઠાલુ હાઇટ	તો. પ્રતેવા, તુવર, કહેવા, ખલાણા, ગુજરાન ખાંતી વેશિનીઓમાં કોર્લીએલ વિલક્ત વર્ષના ( બિલ્લીટ (સ્ટ્રાસ્ટ અને લીક્સાંતા વાદાય ભાગ અને હિલ્લા કેવાફ્ય ૧૮૧ મો. કુટ્યોની, પાફિની, પ્રતિ નેતી. અનુિલ્લલ કોર્યોલન સોર્પનં ૧, પ્રતીન્ક ફાલેટ, કલિકા પેલેલ, ખાર્ટ લીન લીલી લોકાવાદી તુર્વે મીડીય હો. પ્રતેવા, તુવર, કાર્કારા, ખલાણા, ગુજરાન ખાંતી દેશી-બીલા કોર્યોલા બિલાક વર્ષના ( બિલ્લીટ) સ્ટ્રાસ્ટ અને લીક્સાંતા વાદાય ભાગ અને હિલ્લા કેવાફ્ય ૧૮૧ મો. કુટ્યોના કોર્યોની લી.	
લાભુવાઇ પોતાનવાઇ વિદ્યારો, કાર્યો હોંદ લાભુવાઇ પોતાનવાઇ (સત-વેદાધારે), કાર્યો હોંદ લાભુવાઇ પ્રતિ હોંદ (સત-વેદાધારે) (A.K.O.), 1,600100610860333, લાભુવાઇ પોતાનવાઇ (દિવાધારે), આવેલાં લાભુવાઇ પોતાનવાઇ (દિવાધારે), વ્યાવણોન્દે લાભુવાનાં આવેલાં (સત-વેદાધારે), બાદમાં (A.K.O.),1,6001060116661428, લાભવાઈ દાંદણ સંદેશે (દિવાધારે) સુવાદ મોદી માર્નવાદ	૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ ૦૩. ૪૪૮/- રૂદ. આઠ લાખ પોતેર રાજા ૨ ખલો યુડાલીસ યુદ્ધ ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ આઠ લાખ એઠાલુ તજા ૨ સાતાઓ બાલન યુદ્ધ ૧૨-જુલાઇ-૨૧ મુજબ ૧૨-ઓડિએલ-૨૧	રોડ, પ્રશેશ, મુક્ત, કરીકા, પલ્લાકા, ટુપ્પાલ ખેતી પોર્ટી ખેતીએ મોર્નીઓન મિલેક્સ વિવાર વધ્યે. વિલ્લી / કુટપાલ ખેતી કોલ્સમાં લાધમ લાગ વર્ષ દિશામાં સેવાલ ૧૮ સો કુટ્યાંના મોર્નીઓ, માર્કિઓ, માર્કિ	
જામુલ્લા ખેતનભાઇ (વેલાવર), અદીવીલા અમુલલા ખેતનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા જામુલલા અંતિનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા જામુલલા અલી વેલા (તાન-વેલાવર) (APA NO.) LBOOI (6000116660338), જામુલલા ખેતનભાઇ (વિલાવર), સાર્યુલલા ખેતનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા નામામુલલા અંદિલાવર (તાન-વેલાવર), નદુવારોલા નામામુલલા અંદિલાવર (તાન-વેલાવર), ત્યારા (APA NO.) LBOOI (600116601438), નામામાં દારા (તાન-વેલાવર), નામામાં (તાન-વેલાવર), મિત્ર ભાગી	૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ ૦૩. ૪૪૮/- રૂદ આઠ લાખ બોતેર તજાર બલો શું ડ્રતાલીસ યુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ રૂદ ડલ્પ, ૦૫૨/- રૂદ આઠ લાખ એકતા તજાર સામકાનો બાલવ યુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૧૨-ઓક્ટોબર-૨૧ રૂદ ૧૪.૪૬૬૫૬/-	તો. પ્રત્યેવા, મુક્ત, કહેવા, ખલાવા, મુખ્યત ખંતીને વિતિ ખીતાં મોહેલીઓ વિધાન કંપની ( બિલ્લીક, મુક્ત અને લીક્સલીના લાધા વાય અને હિલ્લા, <b>લેવફલ ૧૮૬ મો. કૃત્</b> યોના માર્ચિક, મી. મુખ્યત્વન કંપનીરાત મોપ નં. v. માર્ગન કંપોર, કંપતા પેલા, ખાર્ટ કીન મીડી લોકા થઈ નું પી કીમ લીક, માર્ચાર, મુલ્લા, મોર્કાન, પલાવાન, પુષ્પતા ખાંતીને વિતિ પ્રત્યોના કોનેલીઓ બિલ્લાન પ્રત્યોને, બિલ્લીક (પુષ્પતા અને કોન્સના લાધા લાધ અને બંદિલા, <b>લેવફલ ૧૯૬ મો. કૃત્યોના મોર્ચાની</b> , કોર્યોના મોર્ચાની, કોર્યોના કોર્યોના મોર્ચાના કર્યા કર્યું હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા કર્યા કર્યું હતું મોર્ચાના કર્યા કર્યા કર્યા કર્યું હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા કરવા કર્યા કરવા કર્યા કરવા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરા કર્યા કર્યા કર્યા કર	૩૦-શ્વન્યુઆરી-૨૦:
જામુખાઇ મેહેતબજાઇ (વેલાકોર), આવી પેલા આગુમાળા મેહેતબજાઇ (તાન-પેલાકોર), માર્ચી પેલા આગુમાળા મેહેતબજાઇ (તાન-પેલાકોર), માર્ચ્યુપાલેન જામુખાલા અદિલાનો (તાન-પેલાકોર), (AM-No.) 1.50001000115600353, આગુમાળા મેહેતબજાઇ (દેલાકોર), માર્ચ્યુપાલેન જામુખાલા કાર્યો પ્રદાન (તાન-પેલાકોર), માર્ચ્યુપાલેન જામુખાલા કાર્યો પ્રધા (તાન-પેલાકોર), માર્ચ્યુપાલેન જામુખાલા કાર્યો પ્રધા (તાન-પેલાકોર), આગળા દિલાકોર કાર્યુપાલે (દેલાકોર) જુલા કોર્યો માર્ચિયક મોરવાલા (તાન-પેલાકોર), hiratesis	૨૨-જુલાઇ-૨૧ મુજબ ૨૬જુલાઇ-૨૧ રૂક ૭૨, ૪૪૮/- રૂક. આઠ લાખ પોતેર તાલર બસો યુ ડાતારીત યુસ્ટ ૨૬-જુલાઇ-૨૧ મુજબ ૨૬-જુલાઇ-૨૧ તાલર સાતદો બાલવ યુરા ૨૨-જુલાઇ-૨૧ મુજબ ૧૨-ઓઠઠોબર-૨૧ રૂક. ચેડ. ૯૧, ૬૫ ૬/-	રોડ, પ્રશેશ, મુક્ત, કરીકા, પલ્લાકા, ટુપ્પાલ ખેતી પોર્ટી ખેતીએ મોર્નીઓન મિલેક્સ વિવાર વધ્યે. વિલ્લી / કુટપાલ ખેતી કોલ્સમાં લાધમ લાગ વર્ષ દિશામાં સેવાલ ૧૮ સો કુટ્યાંના મોર્નીઓ, માર્કિઓ, માર્કિ	૩૦-શ્વન્યુઆરી-૨૦:
જામુલ્લા ખેતનભાઇ (વેલાવર), અદીવીલા અમુલલા ખેતનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા જામુલલા અંતિનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા જામુલલા અલી વેલા (તાન-વેલાવર) (APA NO.) LBOOI (6000116660338), જામુલલા ખેતનભાઇ (વિલાવર), સાર્યુલલા ખેતનભાઇ (તાન-વેલાવર), નદુવારોલા નામામુલલા અંદિલાવર (તાન-વેલાવર), નદુવારોલા નામામુલલા અંદિલાવર (તાન-વેલાવર), ત્યારા (APA NO.) LBOOI (600116601438), નામામાં દારા (તાન-વેલાવર), નામામાં (તાન-વેલાવર), મિત્ર ભાગી	ર-(બ્લાઇ-ર ૧ મુખલ ૨૬-(બલાઇ-ર ૧ મુખલ ૨૬-(બલાઇ-ર ૧ ટ્રા-સાદ લાખ લોતે ર તાલર ર ૧ મુખલ ૨૬-(બલાઇ-ર ૧ મુખલ ૨૬-(બલાઇ-ર ૧ મુખલ ટ્રા-સાદ લાખ એકાલુ તાલર ટ્રા-સાદા લાખ એકાલુ તાલર ૨૨-(બલાઇ-ર ૧ મુખલ ૧૧ - આક્રેડોલ-ર ૧ ટ્રા-શેલ લાખ લોખન તાલર છતો છળાન યુરા	તો. પ્રત્યેવા, મુક્ત, કહેવા, ખલાવા, મુખ્યત ખંતીને વિતિ ખીતાં મોહેલીઓ વિધાન કંપની ( બિલ્લીક, મુક્ત અને લીક્સલીના લાધા વાય અને હિલ્લા, <b>લેવફલ ૧૮૬ મો. કૃત્</b> યોના માર્ચિક, મી. મુખ્યત્વન કંપનીરાત મોપ નં. v. માર્ગન કંપોર, કંપતા પેલા, ખાર્ટ કીન મીડી લોકા થઈ નું પી કીમ લીક, માર્ચાર, મુલ્લા, મોર્કાન, પલાવાન, પુષ્પતા ખાંતીને વિતિ પ્રત્યોના કોનેલીઓ બિલ્લાન પ્રત્યોને, બિલ્લીક (પુષ્પતા અને કોન્સના લાધા લાધ અને બંદિલા, <b>લેવફલ ૧૯૬ મો. કૃત્યોના મોર્ચાની</b> , કોર્યોના મોર્ચાની, કોર્યોના કોર્યોના મોર્ચાના કર્યા કર્યું હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા કર્યા કર્યું હતું મોર્ચાના કર્યા કર્યા કર્યા કર્યું હતું કર્યો કૃત્યોના મોર્ચાના કર્યા કરવા કર્યા કરવા કર્યા કરવા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કર્યા કર્યા કરવા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કરમા કર્યા કરમા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કરા કર્યા કર્યા કર્યા કર	૩૦-શ્વન્યુઆરી-૨૦:
જામુવાઇ પેલેલબંલા (વેલાકો), સાર્વિયા લાગાવાળ પેલેલબંલા (વેલાકો), સાર્વિયા લાગાવાળ પેલેલબંલા (વેલાકો), સાર્વિયા લાગાવાળ પેલેલબંલા (વેલાકો), સાર્વિયા લાગાવાળ પેલેલબંલા (વેલાકો), (AM-No.) (10001000119600353), જામુવાલા પેલેલબંલા (વેલાકો), સાર્વુલાએ ભાગુભાલ કર્યાં લાગાવાળ (લેલ-પેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લિયા (લેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લિયા (લેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લિયા (લેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લેલાકો), સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લેલાકો, સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લેલાકો, સ્ટ્રાફ્ટાએન ભાગુભાલ કર્યાં લેલાકો, સ્ટ્રાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટાફ્ટ	ર ર જુલા ર મુજબ કર્યુલા ર મુજબ કર્યુલા ર સ્થાર એક્સ લાક લાકો મુક્યાલી ર સ્થાર સ્ટ ર ર જુલા ર ર મુજબ સ્ટ ર ર જુલા ર ર સ્ટ ર ર મુજબ કર્યુલા ર ર સ્ટ ર ર પ્રકૃત સ્થાર સ્ટ ર સ્થાર ર મુજબ કર્યુલા ર સ્થાર સ્ટ ર જુલા ર સ્થાર કર્યુલા ર મુજબ કર્યુલા ર મુજબ કર્યુલા ર સ્થાર સ્ટ ર જુલા ર સ્થાર સ ર જ પાર્ટ ર કર્યુલા સ સ સ માજ સ્થાર અલે આપન મુસ્લ કર્યુલા ર સ્થાર કર્યુલા	રોડ, પ્રસંત મુક્ત, કરી રહેલ, ખલાવા પણ વાર ખંગીની દેવી ખીતી કર્યા કરી છેલી પણ કરવી છે. દિવસી / 12 માત્ર અને દીસ્વર્લલ લાગા વાર અને દિવસા, સેવલલ કરતે હો, ક્યાંની, સાફેની, સાફ	૩૦-શ્વન્યુઆરી-૨૦:
ભાગુવામાં પ્રેતાનભાઇ વિદ્યાસંદે, આવેલીયા પાછ્રમાં પ્રેતાનભાઇ (તાન-દેવાસંદે), સ્ત્રાંગેલે નામુખાં અંતિનભાઇ (તાન-દેવાસંદે), સ્ત્રાંગેલે નામુખાં અંતિ (તાન-દેવાસંદે), સ્ત્રાંગેલે નામુખાં અંતિનભાઇ (તાન-દેવાસંદે), સ્ત્રાંગેલે નામુખાં અંત્રેનભાઇ (તાન-દેવાસંદે), સ્ત્રાંગેલે નામુખાં અંત્રેનભાઇ (તાન-દેવાસંદે), (APA IO), 15001000118601428, નામલા દિવાસને આદેવ (તાન-દેવાસંદે) (APA IO), 1500100011787019, મહિલા નામુખાં (તાન-દેવાસંદે) (APA IO), 15001000117877019,	રે ર-જુલાળ-૨૧ મુજલ દે દ. જુલાળ-૨૧ મુજલ દે દ. જુલાળ-૧૧ ટ્રા. આદ લખ ઓરે દ્રાલાથી કરાય રે ર-જુલાળ-૨૧ મુજલ રે ર-જુલાળ-૨૧ મુજલ સાતનો વાળ-૧૧ મુજલ રે ર-જુલાળ-૨૧ મુજલ દે ર-જુલાળ-૨૧ મુજલ દે ર-જુલાળ-૧૧ મુજલ દ્રા. ૧૧ પાઇ-૧૧ દ્રા. ૧૧ પાઇ-૧૧ મુજ છત્તો છળાળ ૧૧ પ્રાપ્ત ૧૧ - ઓરોબેલ્ટ-૨૧ મુજ ૧૧ - ઓરોબેલ્ટ-૨૧ મુજ	હો. પ્રસંત મુક્ત કરેલા પ્રવાસ પુત્ર અલ્લો કરોની લોકો નીકા કોરોલી કર્યા કરવા કરેલા કરતા હતી. કિલ્લો કરાય કરતા અને હોંગાના લાગ લાગ અને હિલ્લા સેવાલ કરતા હો, કહેલાં હો	૩૦-શ્વન્યુઆરી-૨૦:
જામુવાઇ પેલેલબંલા (વેલાકર), માર્ચ લિયા લાગ્યુવાઇ પેલેલબંલા (તેલાકર), માર્ચ લિયા લાગ્યુવાઇ પેલેલબંલા (તેલાકર), માર્ચ્યુવાએ ભાગુવાલા કરીલં (તેલાકર), (Ae.No.) 1,50001000115660353, માર્ચ્યુવાએ ભાગુવાલા કરીલાકર), માર્ચ કર્યા લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં (લાગ્યુવાલા), માર્ચ કર્યા લાગ્યુવાલા કરીલાં (લાગ્યુવાલા), માર્ચ લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં માર્ચ લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં માર્ચ લાગ્યુવાલા લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 15001000117677999, માર્ચ લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 1500100011767799, માર્ચ લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 1500100011767799, માર્ચ લાગ્યુવાલા (Ae.No.), (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 15001000117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 150	રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ સુખ્ય રે કેન્દ્રુપાલાન્સ સુખ્ય રહે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મેલ્દ્રા તથાર સામળે માનવ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મેલ્દ્રા તથાર રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય મ	હો. કાર્યકા, મુલ્લ, કરેલા, પલ્લાલા, કુપલા અંગલે સિંદીઓમાં કારિયોલા કોરોલીલા ફિલ્મલ વર્ષનો, ફિલ્મલી (સ્ટ્રેસ) સ્ટ્રાલિયા કોરોલીલા કોરોલી કરી હતી. તે, કર્યાં કે ક્લેલ કર હતે હો હતુંથી, લાકિયોલા કોરોલી સાંસ્થાની કરી હતી. તે, કર્યાં કે કરેલા કરેલા કરેલા કે કરેલા હતું હતું કરી છે. આ કોરોલી સાંસ્થાની કુપલે કરી હતું કરી છે. આ કોરોલા કર્યાં કરેલા, આવાલા, કુપલ અને કોરોલીઓમાં કરી હતી હતા કરી હતું કરી છે. આ કોરોલા કરેલા	૩૦-જ્ઞન્યુઆરી-૨૦:
ભાગુમાં મેહનભાઇ વિલાસો, મહેવીયા લાગુમાં મેહનભાઇ (લહેનોસાર), સ્ક્રાંટ્રેલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (અને સ્ક્રાંટ્રેસ), સ્ક્રાંટ્રેલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (અને આદર), સ્ક્રાંટ્રેલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (લહેનોસાર), સ્ક્રાંટ્રેલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (લહેનોસાર), સ્ક્રાંટ્રલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (લહેનોસાર), સ્ક્રાંટ્રલ અમુખ્યા અંદ્રેલ પાર્ટ (લહેનોસાર), (APA No.) 15001000119501428, મહિલા નાલુકાલ (લહેનોસાર) (સ્ક્રિંગ આવ્યાના (લહેનોસાર) (સ્ક્રિંગ અને પ્રાથમાં (લહેનોસાર), (સ્ક્રિંગ સંક્રિંગ સંક્રિંગ કે મોર્કિલ (લિયાર), (સ્ક્રિંગ સંક્રિંગ સંક્રિંગ કે સ્ક્રિંગ કે સ્ક્રિંગ કર્યા કર્યું (લાનોસાર), સ્ક્રિંગ સંક્રિંગ કર્યા (લાનોસાર), સ્ક્રિંગ સંક્રિંગ સંક્રિંગ કર્યા (લાનોસાર), સ્ક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સંક્રિંગ સ્ક્રિંગ સંક્રિંગ સંક્	ર ૧-(લાઇ-૨૧ મુજલ ૧-(૧-૧૧ મુક્ક ૧-૧-૧૧ મુક્ક ૧-૧-૧-૧૧ મુક્ક ૧-૧-૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧-૧ મુક્ક ૧-૧ મુક્ક ૧-	હો. પ્રસંત મુક્ત કરેલા પ્રવાસ પુત્ર અલ્લો કરોની લોકો નીકા કોરોલી કર્યા કરવા કરેલા કરતા હતી. કિલ્લો કરાય કરતા અને હોંગાના લાગ લાગ અને હિલ્લા સેવાલ કરતા હો, કહેલાં હો	૩૦-જન્યુઆરી-૨૦ ૩૦-જન્યુઆરી-૨૦ ૩૦-જન્યુઆરી-૨૦ ૨૮-જન્યુઆરી-૨૦
જામુવાઇ પેલેલબંલા (વેલાકર), માર્ચ લિયા લાગ્યુવાઇ પેલેલબંલા (તેલાકર), માર્ચ લિયા લાગ્યુવાઇ પેલેલબંલા (તેલાકર), માર્ચ્યુવાએ ભાગુવાલા કરીલં (તેલાકર), (Ae.No.) 1,50001000115660353, માર્ચ્યુવાએ ભાગુવાલા કરીલાકર), માર્ચ કર્યા લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં (લાગ્યુવાલા), માર્ચ કર્યા લાગ્યુવાલા કરીલાં (લાગ્યુવાલા), માર્ચ લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં માર્ચ લાગ્યુવાલા કરીલાં લાગ્યુવાલા કરીલાં માર્ચ લાગ્યુવાલા લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 15001000117677999, માર્ચ લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 1500100011767799, માર્ચ લાગ્યુવાલા કરીલાં (Ae.No.), 1500100011767799, માર્ચ લાગ્યુવાલા (Ae.No.), (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 1500100011767799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 150010001176799, (Ae.No.), 15001000117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 1500100117679, (Ae.No.), 150	રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ સુખ્ય રે કેન્દ્રુપાલાન્સ સુખ્ય રહે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મેલ્દ્રા તથાર સામળે માનવ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મેલ્દ્રા તથાર રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય રે કેન્દ્રુપાલાન્સ મુખ્ય મ	હો. કાર્યકા, મુલ્લ, કરેલા, પલ્લાલા, કુપલા અંગલે સિંદીઓમાં કારિયોલા કોરોલીલા ફિલ્મલ વર્ષનો, ફિલ્મલી (સ્ટ્રેસ) સ્ટ્રાલિયા કોરોલીલા કોરોલી કરી હતી. તે, કર્યાં કે ક્લેલ કર હતે હો હતુંથી, લાકિયોલા કોરોલી સાંસ્થાની કરી હતી. તે, કર્યાં કે કરેલા કરેલા કરેલા કે કરેલા હતું હતું કરી છે. આ કોરોલી સાંસ્થાની કુપલે કરી હતું કરી છે. આ કોરોલા કર્યાં કરેલા, આવાલા, કુપલ અને કોરોલીઓમાં કરી હતી હતા કરી હતું કરી છે. આ કોરોલા કરેલા	૩૦-જ્ઞન્યુઆરી-૨૦:

PREMIER SYNTHETICS LIMITED CIN - L70100GJ1970PLC100829 g. Office: Surana House, Behind Klassic Chan Swastik X Rd, Opp. Narnarayan Complex

NOTICE vavrangpura, Ahmedabad-3890U9, ir iliai, to consider & approve the Unaudi Financial Results for the Quarter and N months ended on 31st December, 20 and to transact any other business w the permission of chairman. For furt letalis please refer the web-link httl.

Date : 01/02/2022 Vismay Makwa



**♦** The Indian **EXPRESS** 

### NOTICE REGARDING LOSS OF SHARE CERTIFICATES

NOTICE is hereby given that the below mentioned share certificates of ZENSAR TECHNOLOGIES LTD, having its Registered Office at: Zensar Knowledge Park, Khandar PLOT NO 4 MIDC Pune- 411.004 are loss/misplaced and the Company is in the process of issuing duplicate share certificates in lite threaf on request made by the Registered shareholder and on execution of documents required for issue of duplicate share certificates.

FOLIO	Name of registered Shareholder	Certificate Numbers	Distinctive Nos. (from)	Distinctive Nos. (to)	No. of Shares
100588	Late Indira	82400	7210158	7210162	5
	Rajagopalan	64651	5633507	5633526	20
		82401	7210163	7210166	4
		82399	7210133	7210157	25
					54

Any person who has a valid claim on the said shares may lodge such claim with the Company at its Corporate Office within 15 days hereof failing which the Company will issue duplicate share certificates and no claim will ite thereafter.

Place: Pune Date : 01-02-2022



### KRSNAA DIAGNOSTICS LIMITED

Corporate Identity Number: L74900PN2010PLC138068
Registered and Corporate Office: S.No. 233A, Hissa No. 6, CTS No. 4519, 4519/1, Near Chinchwad Station
Clinichwad, Talkida — Havelle, Pune – 111 1019, Maharashira.
Contact Person: Nikhil Deshpande, Company Secretary and Compliance Officer
Telephone: +191 22978 2017/1112; Email: investors@jkrasidaginostics.com; Website: www.kranaadiagnostics.com

Krsnaa delivers robust performance with Revenues of INR 347 Crores and EBITDA\* of INR 105 Crores & margins of 30.2% in 9M FY22 Revenue up by 16%, EBITDA\* up by 73% and PAT is up by 215%\*\*

### Extract of Unaudited Consolidated Financial Results for the Quarter and Nine Months Ended December 31, 2021

SI. No.	Particulars	Quarter Ended December 31, 2021 (Unaudited)	Quarter Ended September 30, 2021 (Unaudited)	Nine Months Ender December 31, 202 (Unaudited
1.	Total Income from Operations	1,108.07	1,114.93	3,580.1
2.	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	213.53	166.20	666.2
3,	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	213.53	166.20	666.2
٠.	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	163.32	125.26	504.5
	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)	163.26	125.18	504.3
ŝ.	Equity Share Capital	156.99	156.99	156.9
	Earnings Per Share (Face Value of ₹ 10/- each as on December 31, 2020 and ₹ 5/ each as on December 31, 2021) (for continuing and discontinued operations) -			
	1. Basic:	5.67	4.51	17.4
	2. Diluted:	5.64	4.47	17.4

Notes:

1) These unsudited consolidated financial results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors of The Höding Company at its meeting held on January 31, 2022.

2) The above Stitement has been prepared in accordance with the Indian Accounting Standards notified under Section 133 of the Companies Act 2013, as amended, read with relevant rules thereunder and in terms of Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements) 2015, as amended.

SI. No.	Particulars		Nine Months Ended December 31, 2021 (Unaudited)	Quarter Ended December 31, 2020 (Unaudited)			
а	Revenue	1,063.11	3,470.46	978.50			
b	Profit Before Tax	222.52	675.42	55.99			
С	Net Profit for the period	172.31	513.75	39.93			
d	Other Comprehensive Income/(Losses)	(0.06)	(0.22)	0.94			
۰	Total Comprehensive Income	172.25	513 53	40.87			

94/

Pallavi Bhate Managing Director

Place: Pune Date: January 31, 2022